

લોકરક્ષક ભરતી પરીક્ષા

લોકરક્ષક ભરતી બોર્ડ ધ્વારા તા.૦૬/૦૧/૨૦૧૯ નાર રોજ યોજનાર લેખિત પરીક્ષા માટે સંબંધીત ઉમેદવારોએ નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.

- (૧) પરીક્ષા સ્થળે પહોંચવા તા.૦૫/૦૧/૨૦૧૯ ની વહેલી સવારથી તા.૦૬/૦૧/૨૦૧૯ ના રોજ સવારના કલાક: ૦૯.૦૦ વાગ્યા સુધી પરીક્ષા સ્થળે જવા માટે વિનામૂલ્યે પ્રવાસ કરી શકાશે.
- (૨) તા.૦૬/૦૧/૨૦૧૯ ના રોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ રાત્રીના કલાક: ૨૪.૦૦ સુધી વિનામૂલ્યે પ્રવાસ કરી શકાશે.
- (૩) ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ રહેઠાણથી નજીકના ડેપો / કંટ્રોલ પોઇન્ટથી પરીક્ષાના સ્થળે આવવા - જવા માટે જ વિનામૂલ્યે પ્રવાસનો લાભ મળવાપાત્ર થશે.
- (૪) આ મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ધ્વારા તા.૦૨/૦૧/૨૦૧૯ બુધવાર ના રોજથી કચેરી સમય દરમ્યાન એડવાન્સ બુકીંગની સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે. જેમાં ઉમેદવારોએ નિગમના નજીકના બસ સ્ટેન્ડ તેમજ કંટ્રોલ પોઇન્ટ ઉપર જઈને પોતાનો કોલલેટર અને અસલ ફોટો આઇ.ડી. પુફ બતાવેથી એડવાન્સમાં પોતાની વિનામૂલ્યે ટીકીટ જવા અને આવવા માટે બુક કરાવી શકાશે અને જે સુવિધા એક્સપ્રેસ, ગુર્જરનગરી અને નોન એ.સી. સ્લીપર પુરતી જ મળી શકશે. સદરહું સુવિધા ઉમેદવારોને વાહન ઉપલબ્ધતા ધ્યાને રાખીને પુરી પાડવામાં આવશે.
- (૫) એડવાન્સ બુકીંગ ધ્વારા જે ઉમેદવારે પોતાની વિનામૂલ્યે ટીકીટ મેળવેલ છે તેવા ઉમેદવારે પરીક્ષાના સ્થળે જવા અને પરત આવવા માટે પોતાનો કોલલેટર અને અસલ ફોટો આઇ.ડી. કંડક્ટરને માંગણી થયેથી બતાવવાના રહેશે તેમજ પ્રવાસ દરમ્યાન ઉમેદવારે પોતાની એડવાન્સ વિનામૂલ્યે ટીકીટ સાથે રાખવાની રહેશે. જે ઉમેદવારે એડવાન્સ ટીકીટ મેળવેલ નથી તેઓએ બસની મુસાફરી દરમ્યાન પોતાનો કોલલેટર ને ને સલ ફોટો આઇ.ડી. બતાવી વિના મૂલ્યેની ટીકીટ કંડક્ટર પાસેથી મેળવવાની રહેશે.
- (૬) પરીક્ષા સ્થળે જવા અને પરત આવવા માટે ઉમેદવારે કોલલેટર તેમજ લોકરક્ષક ભરતી બોર્ડ ધ્વારા માન્ય રખાયેલ અસલ આઇ.ડી. (ઓળખપત્ર) ફરજિયાત પણે સાથે રાખવાનું રહેશે અને તો જ વિનામૂલ્યે પ્રવાસનો લાભ લઈ શકાશે.
- (૭) પરીક્ષા સ્થળે જવા અને પરત આવવા માટે એડવાન્સ બુકીંગ સિવાય પણ લોકલ/મીની બસ, એક્સપ્રેસ, ગુર્જરનગરી અને નો એ.સી. સ્લીપ બસમાં જ ઉપલબ્ધ વાહનો/બસ મુજબ વિનામૂલ્યે પ્રવાસનો લાભ ઉમેદવારો લઈ શકશે.
- (૮) પરીક્ષા સ્થળે જવા અને પરત આવવા માટે એ.સી. સ્લીપર, એ.સી. ૨ x ૨ અને વોલ્વો ૨ x ૨ બસ સર્વિસમાં વિનામૂલ્યે પ્રવાસનો લાભ ઉમેદવારોને મળવાપાત્ર નથી.